

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને માય મેઇન સ્ટ્રીટ (My Main Street) સાથે ભાગીદારી કરીને છ મુખ્ય સ્ટ્રીટ વિસ્તારોના પુનરોદ્ધાર (રિવાઇટલાઇઝેશન) માટે \$945K નું રોકાણ સુરક્ષિત કર્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 24, 2022) – સીટી ઓફ બ્રેમ્પટને [માય મેઇન સ્ટ્રીટ લોકલ બિઝનેસ એક્સેલરેટર પ્રોગ્રામ](#) મારફતે \$945,000 નાં પરત-ચૂકવણી રહિત ફાળાને મંજૂરી આપીને બ્રેમ્પટનમાં છ મેઇન સ્ટ્રીટના સમુદાયોના પુનરોદ્ધારને સહાયરૂપ બનશે: ડાઉનટાઉન, માઉન્ટ પ્લીઝન્ટ, અપટાઉન, કેનેડી રોડ (ઓરેન્ડા કોર્ટથી ગ્લાઇડન રોડની દક્ષિણે), બ્રેમલી GO અને ક્વીન સ્ટ્રીટ (સેન્ટર સ્ટ્રીટથી 410, ડિક્સી રોડથી બ્રેમલી રોડ અને ટોરબ્રામ રોડથી CN રેઇલ લાઇન).

આ છ મુખ્ય સ્ટ્રીટના સમુદાયોને સીટીની ઈકોનોમિક ડેવલપમેન્ટ ઓફિસમાં સમર્પિત મેઇન સ્ટ્રીટ એમ્બેસેડરથી સહાયતા મળશે. પ્રોગ્રામના ભાગરૂપે, નવા અને હયાત નાના ધંધાઓને સહાયતા કરવા સમુદાયોને ગ્રાહકલક્ષી માર્કેટ રિસર્ચ, ડેટા એનાલિસિસ અને પરત-ચૂકવણી રહિત ભંડોળ ફાળો પણ મળશે.

આ કાર્યક્રમ બે વર્ષ ઉપરાંતના સમયમાં પહોંચાડાશે અને તે રહેવાસીઓ, નવા ઉદ્યોગ સાહસિકો, અને હયાત ધંધાઓને મેઇન સ્ટ્રીટના સમુદાયોમાં આર્થિક તકો પૂરી પાડતી વખતે ગતિશીલ અને સર્વગ્રાહી સ્થાનિક મેઇન સ્ટ્રીટ્સ બનાવવા અને જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

COVID-19 મહામારી સામે પ્રતિક્રિયા કરવામાં, ગવર્નમેન્ટ ઓફ કેનેડાએ [ફેડરલ ઈકોનોમિક ડેવલપમેન્ટ એજન્સી ફોર સર્ધર્ન ઓન્ટેરિયો \(ફેડરલ ઓન્ટેરિયો\) મારફતે](#), માય મેઇન સ્ટ્રીટ સ્થાપવા માટે કેનેડિયન અર્બન ઈન્સ્ટિટ્યુટ (CUI) અને ઈકોનોમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઓન્ટેરિયો (EDCO) ને [\\$23.25-મિલિયનના રોકાણની ઘોષણા](#) કરી — માય મેઇન સ્ટ્રીટનો બે વર્ષીય કાર્યક્રમ, બે કાર્યક્રમ પ્રવાહો મારફતે દક્ષિણ ઓન્ટેરિયોમાં મુખ્ય સ્ટ્રીટ્સ અને સ્થાનિક ધંધાઓની રિકવરી અને પુનરોદ્ધારને સહાયતા કરશે.

માય મેઇન સ્ટ્રીટ લોકલ બિઝનેસ એક્સેલરેટર કાર્યક્રમ પ્રવાહ EDCO દ્વારા વિતરિત થઈ રહ્યું છે, જે મુખ્ય સ્ટ્રીટના 65 સમુદાયોના પુનરોદ્ધારને સહાયતા કરે છે અને સમગ્ર દક્ષિણ ઓન્ટેરિયોમાં 650 થી વધારે સ્થાનિક ધંધાઓ માટે પરત-ચૂકવણી રહિત ફાળો પૂરો પાડે છે.

કાર્યક્રમની વિગતો અને વધુ માહિતી માટે વેબસાઇટ www.mymainstreet.ca જુઓ અથવા બ્રેમ્પટન એન્ટરપ્રેન્યોર સેન્ટરનો સંપર્ક Bec@brampton.ca ને ઈમેઇલ મોકલીને કરો.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન તકો આપતું શહેર છે, અને આપણે સાથે મળીને COVID-19 મહામારીના પ્રભાવો દૂર કરવા કાર્યરત છીએ ત્યારે અમે આપણાં સ્થાનિક ધંધાઓને સહાયતા કરવા કટિબદ્ધ છીએ. સરકાર અને સામુદાયિક ભાગીદારોના બધાં સ્તરો સાથેનો સહયોગ આમાં મહત્વનો ભાગ ભજવે છે. અમે માય મેઇન સ્ટ્રીટ લોકલ બિઝનેસ એક્સેલરેટર પ્રોગ્રામ મારફતે આપણાં સમગ્ર શહેરના છ સમુદાયો માટે \$945,000 મળવા બદલ આભારી છીએ. તે આપણાં મહાન શહેરમાં સ્થાનિક ધંધાઓને ટેકો આપવામાં અને બજારમાં તકો વધારવામાં અમને મદદરૂપ થશે.”

- પૅટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“મુખ્ય શહેરના સમુદાયો શહેરના અર્થતંત્રમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે, અને ઘણી વાર સમુદાય નિર્માણ અને સંબંધો રચાતા હોય ત્યાં જોવામાં આવે છે. અમે ફેડરલ ઓન્ટેરિયોમાં અમારા ભાગીદારોના આ મહત્વના રોકાણ માટે આભારી છીએ, અને તેઓ દ્વારા આ છ મુખ્ય સ્ટ્રીટના

સમગ્ર સમુદાયોમાંના આપણાં બ્રેમ્પટનવાસીઓ, નવા ઉદ્યોગ સાહસિકો અને હયાત ધંધાઓ માટે ઊભી થતી આર્થિક તકો અનુભવવા આશાવાદી છીએ.”

- માર્ટિન મેડેરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન માટે માય મેઈન સ્ટ્રીટનો \$945,000 નો ફાળો આપણી મુખ્ય સ્ટ્રીટ્સને વિકસાવવાની ખાતરી કરવામાં અને આપણને COVID-19 મહામારીના પ્રભાવોમાંથી પસાર થઈને આગળ વધીને આબાદ થવામાં મદદરૂપ થશે. આ છ સમુદાયો આપણાં શહેરના અર્થતંત્ર માટે કેન્દ્રમાં છે, અને તેઓને વધારે તકો પૂરી પાડવાથી, આપણું સમગ્ર શહેર લાભાન્વિત થશે.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; ઉપાધ્યક્ષ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“શહેરમાં, અમે નોંધપાત્ર સ્થાનિક રોકાણો અને ભાગીદારીઓ મારફતે સમગ્ર બ્રેમ્પટનવાસીઓ અને ધંધાઓ માટે તક પૂરી પાડવા સમર્પિત છીએ. માય મેઈન સ્ટ્રીટ લોકલ બિઝનેસ એક્સલેરેટર પ્રોગ્રામના ફાળાથી આપણાં સમુદાયમાં રોકાણ આવશે અને આપણાં શહેરનો ફેલાવો અને વિકાસ માટે સહાયરૂપ બનશે. અમે આપણાં શહેરને આબાદ થવા જરૂરી સાધનો મળી રહે તેવી ખાતરી કરવા અમારા ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“ઘવર્મેન્ટ ઓફ કેનેડા મહામારીના પરિણામ સ્વરૂપે મુખ્ય સ્ટ્રીટના ધંધાઓ જે પડકારોનો સામનો કરી રહ્યાં છે તેનાથી માહિતગાર છે, અને અમે તણાવ ઘટાડવામાં મદદ કરવા કાર્યવાહી કરી રહ્યાં છીએ. સ્થાનિક ધંધાઓને પોતાની મેઈન સ્ટ્રીટ્સમાં ગતિશીલતાનું પુનઃનિર્માણ કરવામાં અને પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થતી નવી અને સર્વગ્રાહી આર્થિક તકોને અનુકૂળ થવાની અને રચવાની રીતો સ્થાનિક ધંધાઓ શોધી કાઢે ત્યારે માય મેઈન સ્ટ્રીટ જેવા કાર્યક્રમો તેઓને નિર્ણાયક ભંડોળ અને સેવાઓ આપવાની તૈયારી બતાવે છે.”

- માનનીય હેલેના જાકઝેક (Helena Jaczek), સધર્ન ઓન્ટેરિયો માટે ફેડરલ ઇકોનોમિક ડેવલપમેન્ટ એજન્સી માટે જવાબદાર મંત્રી

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન (Strategic Communication)

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca